

અટલ પેન્શન યોજના (APY) – આવેદકની માહિતી માટેનું બ્રોશર

- APY 60 વર્ષની ઉંમર બાદ પ્રતિ માસ રૂ. 1000, રૂ. 2000, રૂ. 3000, રૂ. 4000, રૂ. 5000નાં ઓછામાં ઓછા માસિક પેન્શનની ભારત સરકાર દ્વારા અપાયેલ ખાતરીની પસંદગીને પ્રસ્તુત કરે છે.
- APYનું ખાતું ખોલાવવા માટે, આવેદક ભારતનો એક નાગરિક હોવો જોઈએ. આવેદકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
1લી ઓક્ટોબર, 2022થી આવક વેરો ચૂકવનારાઓ APY યોજનામાં જોડાવા માટેની પાત્રતા ધરાવતા નથી.
- આવેદક બેંકની શાખા/પોસ્ટ-ઓફીસ અથવા બેંક દ્વારા પૂરા પાડવામાં આવતા ડીજીટલ ઓનબોર્ડિંગ પ્લેટફોર્મ મારફત APYમાં જોડાઈ શકે છે.
- APY ખાતું ખોલાવતા સમયે નોમીનેશન અને જીવનસાથીની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે.
- યોજનામાં ફાળો બચત બેંક ખાતામાંથી ઓટો ડેબીટ સુવિધા દ્વારા માસિક કે ત્રિમાસિક રીતે અથવા અર્ધ-વાર્ષિક ધોરણે કરી શકાય છે.

60 વર્ષની ઉંમર પ્રાપ્ત કરવા ઉપર અટલ પેન્શન યોજના(APY)નાં ત્રણ ગણા લાભો

- આવેદકને રૂ.1000થી રૂ.5000નું આજીવન ખાતરી અપાયેલ ઓછા ઓછું પેન્શન.
- આવેદકના મૃત્યુ બાદ, જીવનસાથીને પણ આજીવન તે જ રકમનું પેન્શન ચૂકવવાપાત્ર છે.
- આવેદક અને જીવનસાથીનાં મૃત્યુ બાદ નોમિનીને 60 વર્ષની ઉંમર સુધી સંચિત થયેલ પેન્શનની રકમ પરત કરવી.

APY હેઠળ PRAN, લેવડ-દેવડ હિસાબો અને યોગદાન

- www.npskra.nsdl.co.in>> Home>>Atal pension Yojana>> APY e-PRAN/Transaction statement view ની મુલાકાત લઈને નિશ્ચયક કોઈપણ સમયે લેવડ-દેવડ હિસાબો અને PRAN કાર્ડને જોઈ શકાય છે અને તેને પ્રિન્ટ કરી શકાય છે. .
- વેબસાઈટ <https://enps.nsdl.com/eNPS/APYRePrintPRAN.htm>>>Atal Pension Yojana>>Print APY PRAN Card ઉપર જરૂરી રકમ ચૂકવ્યા બાદ આવેદક ડીજીટલ સ્વરૂપમાં PRAN કાર્ડ આપવા માટેની વિનંતી કરી શકે છે. .
- અટલ પેન્શન યોજનામાં નામ નોંધણી કરાવ્યા બાદ, નોંધાયેલા સરનામા એટલે કે અટલ પેન્શન યોજનામાં નામાંકન માટે આવેદકે પૂરા પાડેલ સરનામા ઉપર વર્ષમાં એક વાર ભૌતિક સ્વરૂપે લેવડ-દેવડનાં હિસાબો મોકલવામાં આવશે.
- યોગદાનની સ્થિતિ અંગેની માહિતીની જાણ આવેદકના નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર સામયિક SMS એલર્ટસ મારફત પ્રોટીઅન-CRA દ્વારા કરવામાં આવશે.
- E-PRAN ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડીજી-લોકર ઉપર પણ ઉપલબ્ધ હોય છે.

APY હેઠળ સબસ્ક્રાઈબરની વિગતોમાં સુધારો/ફેરફાર

- સબસ્ક્રાઈબરે APY આવેદક મોડિફિકેશન ફોર્મમાં ઈચ્છિત ફેરફારોની વિગતો ભરવી પડે છે અને વ્યક્તિગત માહિતી જેવી કે સરનામું, ફોન નંબર વગેરેનાં ફેરફાર માટે જરૂરી દસ્તાવેજોની સાથે APY-SP શાખામાં તેને રજૂ કરવું પડે છે. ફોર્મને <https://www.npskra.nsdl.co.in/nsdl-forms.php> ઉપરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
- ઓટો ડેબિટની સંખ્યામાં ફેરફાર જેમ કે ત્રિમાસિક યોગદાનમાંથી માસિક ફાળા અથવા અર્ધ વાર્ષિક યોગદાનમાંથી ત્રિમાસિક યોગદાનને સમગ્ર વર્ષ દરમિયાન APY-SP શાખા સમક્ષ APY આવેદક દ્વારા લેખિત વિનંતી રજૂ કરીને કરી શકાય છે.
- APY આવેદક માટે આધાર સીડિંગની વિશેષતા બહાર પાડવામાં આવેલ છે જેમાં આવેદક વાર્ષિક સમયના ધોરણે, APY ખાતામાં આધારનું અપડેશન- <https://www.npslite-nsdl.com/CRA/ite/> >> Aadhaar Seeding for APY subscribers મારફત કરી શકે છે.

પેન્શનની રકમમાં વધારો/ઘટાડો

- APY આવેદક APY SP શાખા સમક્ષ “APY આવેદક મોડિફિકેશન ફોર્મ” રજૂ કરીને આખું વર્ષ તેમની પેન્શનની રકમમાં વધારો/ઘટાડો કરી શકે છે.ફોર્મ <https://www.npskra.nsdl.co.in>>>Home>>Atal Pension Yojana>>Forms>>Subscriber Maintenance>> ઉપર ઉપલબ્ધ છે.
- વિશેષતા પસંદ કરાયેલ નવી ખાતરીવાળી પેન્શનની રકમ મુજબ જમા કરવાની/પરત મેળવવાની તફાવતની રકમ તપાસવા માટે યુઝરને સક્ષમ બનાવે છે.
- અપગ્રેડ કે વધારાના કિસ્સામાં તફાવતની રકમ જમા કરવી પડે છે અને ડાઉનગ્રેડ કે ઘટાડાના કિસ્સામાં તફાવતની રકમ સબસ્ક્રાઈબરને પરત કરવામાં આવશે.
- રી-ફીક્સેસન પદ્ધતિ મારફત પેન્શન અપગ્રેડની એક નવી વિશેષતા દાખલ કરવામાં આવેલ છે જેમાં ફાળો હાલની ઉંમર અને પેન્શનની રકમમાં તફાવતના આધાર ઉપર ચૂકવવાનો હોય છે. આ પ્રક્રિયામાં, કોઈપણ ઉચ્ચક તફાવતની રકમ જમા કરવી જરૂરી નથી.

APYમાંથી નિર્ગમન

- સ્વેચ્છિક નિર્ગમન (60 વર્ષની ઉંમર પહેલા નિર્ગમન): APY ખાતાઓને બંધ કરવા માટે, યોગ્ય રીતે ભરાયેલ “ખાતા સમાપન ફોર્મ (સ્વેચ્છિક નિર્ગમન)” અને અન્ય સંબંધિત દસ્તાવેજો સંબંધિત

APY-SP શાખા સમક્ષ રજૂ કરવા પડે છે. ફોર્મ: www.npskra.nsdli.co.in>>Home>>Atal Pension Yojana>>Forms>>Withdrawal Form>>Voluntary exit APY withdrawal form ઉપર ઉપલબ્ધ છે. તે APY-SP શાખા ઉપર પણ ઉપલબ્ધ હોય છે. APY ખાતું બંધ કરવામાં આવે તો પણ આવેદકે APY ખાતા સાથે લીંક કરાયેલ બચત બેંક ખાતું બંધ કરવું જોઈએ નહીં કારણ કે સમાપનની આવકો કે જે આવેદકે મેળવવાની બાકી છે, તે APY સાથે લીંક કરાયેલ બચત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. APY સમાપનની આવકો જમા થયા પહેલા બચત બેંક ખાતું બંધ કરવાની બાબત નિર્ગમન કરેલ આવેદક દ્વારા નાણાની પ્રાપ્તિઓમાં સમસ્યાનું સર્જન કરી શકે છે.

- 60 વર્ષ પહેલા APY ખાતાના સબસ્ક્રાઇબરનાં મૃત્યુ ઉપર : જીવન સાથી સબસ્ક્રાઇબરના APY ખાતામાં ફાળો યાવુ રાખવાનો વિકલ્પ કે પસંદગી ધરાવે છે, જે જીવન સાથીના નામે જાળવવામાં આવી શકે છે, બાકીના નિયત સમય સુધી, મૂળ આવેદકે 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોત તે સમય સુધી. જીવન સાથી ખાતાને યાવુ રાખવાનું ના ઇચ્છે તેવા કિસ્સામાં, તેને/તેણીને માત્ર સંચિત થયેલ પેન્સનની રકમ અર્થાત APYને તેના દ્વારા કરવામાં આવેલ યોગદાનની રકમ, તેના યોગદાન ઉપર મળતા યોગ્ય વાસ્તવિક વ્યાજની સાથે(ખાતા જાળવણીના ચાર્જ/સને કાપ્યા બાદ) પરત કરવામાં આવશે.
- મૃત્યુના કારણે નિર્ગમન: દાવેદાર સંબંધિત APY-SP શાખા સમક્ષ મૃત્યુ પ્રમાણપત્રની એક નકલ સાથે "APY સમાપન ફોર્મ(મૃત્યુ)" યોગ્ય રીતે ભરીને રજૂ કરી શકે છે. ફોર્મ www.npskra.nsdli.co.in>>Home>>Atal Pension Yojana>>Forms>>Withdrawal Form>>APY death form ઉપર ઉપલબ્ધ છે. તે APY-SP શાખા ઉપર પણ ઉપલબ્ધ હોય છે..

APY મોબાઇલ એપ્લિકેશન

- APY મોબાઇલ એપ્લિકેશન APY યુઝર્સ માટે નિશુલ્ક ઉપલબ્ધ હોય છે, જ્યાં તાજેતરના 5 યોગદાનને તપાસી શકાય છે અને લેવડ-દેવડ હિસાબ અને e-PRAN પણ કોઈપણ સમયે કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના ડાઉનલોડ કરી શકાય છે. એન્ડ્રોઇડ યુઝર્સ સર્ચ ઓપ્શનમાં 'APY and NPS Lite' ટાઇપ કરીને ગુગલ પ્લે સ્ટોરમાંથી APY મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે.
- APY ચેટ બોટની એક નવી વિશેષતા મોબાઇલ એપ્લિકેશનમાં લાઈવ કરવામાં આવી છે જે ઓછા માનવ હસ્તક્ષેપો સાથે વાસ્તવિક સમયમાં મૂંઝવણોનો ઉકેલ કરવામાં મદદ કરે છે.
- પેન્શન અપગ્રેડ/ડાઉનગ્રેડ કેલ્ક્યુલેટરની ઉપલબ્ધતા.

APY હેઠળ માહિતી મેળવવી અને ફરિયાદ રજૂ કરવી

- આવેદક APY વિષે વધારાની માહિતી મેળવવા માટે પ્રોટીઅન-CRA-અટલ પેન્શન યોજના હેલ્પ ડેસ્ક્નાં (ટોલ ફ્રી) નંબર 1800 889 1030 ઉપર કોલ કરી શકે છે.
- APY ચેટ બોટની એક નવી વિશેષતા વેબ ઉપર લાઈવ કરવામાં આવેલ છે જે ઓછા માનવ હસ્તક્ષેપો સાથે વાસ્તવિક સમયમાં મૂંઝવણોનો ઉકેલ કરવામાં મદદ કરે છે.
- APY ખાતા/યોગદાન સંબંધિત તમામ પૂછપરછો APY-SP શાખા સમક્ષ પણ કરી શકાય છે.
- આવેદક www.npskra.nsdli.co.in >>Home >> select: NPS-Lite ની મુલાકાત લઈને અથવા CGMS મારફત નિશુલ્ક અને કોઈપણ સ્થાનેથી ફરિયાદ રજૂ કરી શકે છે.
- ફરિયાદ રજૂ કરનાર આવેદકને રજૂ કરવામાં આવેલ ફરિયાદ સામે એક ટોકન નંબર ફાળવવામાં આવશે. આવેદક "Check the status of Grievance / Enquiry already registered" હેઠળ ફરિયાદની સ્થિતિને તપાસી શકે છે.

APY સોશિયલ મીડિયા પેજ લીંક્સ

APY, PFRDA પેજ નીચેના ઉપર ઉપલબ્ધ છે - ફેસબુક  https://www.facebook.com/OfficialAPY/ - APY KI PATHSHALA ની યુટ્યુબ લીંક- https://www.youtube.com/channel/UC5SuHg-O6ipH1J_HTFU17ug	PFRDA પેજ નીચેના ઉપર ઉપલબ્ધ છે - લીન્કડીન  https://www.linkedin.com/in/pfrda-pension-fund-regulator-of-india-051614168/?originalSubdomain=in - યુટ્યુબ  https://www.youtube.com/channel/UCLMx1eZWY-LDeyIWCwYu15Q - ટવીટર  https://twitter.com/pfrdaofficial?lang=en
---	---

વધુ વિગતો માટે : નીચેની વેબસાઈટોની મુલાકાત લેવા વિનંતી :

PFRDA વેબસાઈટ: <https://www.pfrda.org.in>>>NPS>>Atal Pension Yojana>>APY Scheme details, <https://www.pfrda.org.in>>>NPS>>Atal Pension Yojana>>FAQs
પ્રોટીઅન- CRA વેબસાઈટ: www.npskra.nsdli.co.in>>Home>>Atal Pension Yojana>>Introduction>>APY Scheme details, www.npskra.nsdli.co.in>>Home>>Atal Pension Yojana>>FAQ's>>APY FAQ's
NPS Trust Website: <http://www.npstrust.org.in> >>Atal Pension Yojana >>APYSchemedetails.pdf, <http://www.npstrust.org.in> >>Atal Pension Yojana >>APYFAQs10092015.pdf

નોંધ : અંગ્રેજી અને અન્ય ભાષાઓ વચ્ચે આ બ્રોશરમાં ભાષાંતર કરાયેલ કોઇપણ સંસ્કરણનાં અર્થો વચ્ચે કોઇપણ વિસંગતતાના કિસ્સામાં, અંગ્રેજી સંસ્કરણનો અર્થ માન્ય રહેશે.

QR CODE

1. APY MOBILE APP

2. APY PODCASTS

a) Downloading APY transactionstatementand PRAN

b) E-APY Process

